

Date: 06.11.2025

To, Gen. Manager (DCS) BSE Limited. P J Towers, Dalal Street, Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th September, 2025 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said unaudited financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **05**th **November, 2025**.

You are requested to take the same on your record.

Thanking You.


Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED

MR. JAYESH PATEL

DIRECTOR

(DIN: 00401109)



PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off: 3rd Floor, H. K. Complex, Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India Ph. 26632390, 26609530 Fax No: +91 79 26612843.

Website: http://www.dharapratiksha.com E-mail: exports@dharapratiksha.com

CIN: L24110GJ1991PLC015507

Factory: 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand. (Dist. Ahmedabad) India. Phone 02717-284350

CHANAKYA

positioning us as a truly pan-

Indian platform. Our embedded

growth prospects remain

strong, supported by continued

leasing momentum, which

positions us well to deliver

value to our unitholders," said

Alok Aggarwal, chief executive

officer and managing director,

The deal has been executed

at a 6.5 per cent discount to its

gross asset value (GAV). It is

expected to increase Brookfield

India Reit's net asset value by

1.7 per cent (pro forma) and the

distribution per unit to

In the first half of FY26,

Brookfield India Reit

announced distributions of

Rs.10.5 per unit, up 15.38 per

After the acquisition,

Brookfield India Reit's

operating area will expand by

31 per cent to 32.3 msf, and its

GAV will surge 34 per cent to

Rs.53,600 crore, it said. The

share of global capability

centres (GCCs) in its tenant

base will also increase to 45 per

cent from 37 per cent, while the

concentration of its top 10

tenants will reduce to 30 per

The asset is leased to a

diverse roster of GCCs,

including Honeywell, Morgan

Stanley, State Street, Standard

Chartered, Shell, KPMG,

Deloitte, and Cadence, among

The transaction will re-rate

the distribution profile of the

Brookfield India Reit, and is

expected to increase the share

of dividends from 16 per cent

to 30 per cent in the near term,

making it attractive to a wider

"We expect the market to

move into a more sophisticated

phase where Reits not only

acquire but also recycle and trade assets within their

portfolios. While India is still

in the early innings of this

evolutionary journey, the

direction is unmistakable —

stronger balance sheets,

greater liquidity, and increasing

capital flows are setting the

stage for a deeper, more liquid,

and globally comparable Reit

market," Kabra added.

unitholder base, it added.

others, Brookfield noted.

cent from 34 per cent.

cent year-on-year.

unitholders by 3 per cent.

Brookfield India Reit.

Mutual fund equity buying in October lowest in six months at Rs.17,778 cr

Equity market deployment by mutual funds (MFs) fell to a six-month low in October, indicating a slowdown in fresh inflows into equity MF schemes as the market recovers.

MFs deployed a net Rs.17,778 crore in equities last month (as on October 30), compared with Rs.46,442 crore in September and Rs.70,534 crore in August, according to data from the Securities and Exchange Board of India (Sebi).

Experts attributed the decline in equity deployment to profit booking and rising valuation concerns, with stock prices nearing record highs.

"The net inflows into MF schemes may also have been lower last month, with investors booking profit and taking a more measured approach amid elevated valuations. Fund managers could also be in a wait-and-watch mode due to the ongoing earnings season, preferring to assess company performance before deploying fresh capital," said G Chokkalingam, founder of Equinomics Research.

The quantum of money that MFs invest largely depends on the pace of inflows and outflows across active, passive, and hybrid schemes. Changes in cash positions and adjustments in the equity allocation of hybrid funds also impact overall deployment

Net inflows into active equity schemes have moderated since hitting an alltime high of Rs.42,702 crore in July. In September, investors had put in Rs.30,422 crore. The decline has largely been attributed to profit booking as markets recovered from the March 2025 lows.

The market recovery continued in October, taking benchmark indices close to their all-time highs.

The Nifty 50 and the Sensex gained about 4.5 per cent each during the month, marking their biggest monthly gains in seven months, supported by improved corporate earnings in the September quarter and steady foreign portfolio inflows.

The outlook for domestic equities, however, remains

"The earnings-valuation matrix remains relatively unfavourable, which helps explain why FPIs have still shied away. Internally, a high volume of promoter sale and IPOs has created a supply overhang. Declining return on equity (RoE) amid rising capital requirements for growth, along with lack of high-tech leaders, has weighed on the Indian market. However, highfrequency indicators point to some uptick in real sectors," ASK Private Wealth said in a report. ICICI Securities said in a note that Nifty 50 ran up by a brisk 5 per cent in October 2025 and 9 per cent in 2025, which, in a low nominal-growth environment, sets the stage for a phase of moderate returns until incremental positive growth surprises emerge.

"Despite modest gains, India's stock performance is lagging most global markets this year, as valuations, despite moderating, are still elevated," it stated.

Giga raises \$61 million to scale AI-driven customer support platform

Giga, an artificial intelligence (AI) startup focused on transforming customer support interactions, said it has raised \$61 million in a Series A funding round led by Redpoint Ventures, with participation from Y Combinator and Nexus Venture Partners.

The company said the fresh funding will be used to expand its technical team and accelerate go-to-market efforts. It will also help scale deployments with large global enterprises as Giga strengthens its position in AI-driven enterprise support automation.

Founded by IIT Kharagpur graduates Varun Vummadi and Esha Manideep, Giga develops AI agents that enable companies to deliver real-time, emotionally aware customer support at scale.

"This is one of our largest early-stage investments to date because we believe deeply in both the strength of the product to reshape the world of customer support and the pace of execution from the Giga team," said Satish Dharmaraj, managing director at Redpoint Ventures.

Abhishek

managing director at Nexus Venture Partners, added that Giga's platform helps global enterprises transition from human and outsourced support to scalable, softwaredriven AI—enhancing efficiency, quality, and compliance.

Giga said its AI agents use contextual memory to understand and respond to customer interactions, enabling rapid deployment across complex enterprise systems in just a few weeks. The system ingests a company's entire support knowledge base and instantly generates high-Sharma, accuracy agents.

Today's Important Weblinks:

https://chanakyanipothi.com/

https://chanakyanipothi.com/grey-market-premium-latest-ipo-gmp/

https://chanakyanipothi.com/ipo-subscription-status/

https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/

https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/ https://chanakyanipothi.com/upcoming-ipos-2025/

https://sahifund.com/

1) https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/

2) https://sahifund.com/latest-new-fund-offers/

3) https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/ 4) https://sahifund.com/icici-prudential-flexicap-fund/

5) Sahifund bottom

https://chanakyanipothi.com/best-stock-to-buy-today/

https://chanakyanipothi.com/news-crux/

https://chanakyanipothi.com/fii-data-today/

https://sahifund.com/fii-dii-buy-sell-activity/ https://chanakyanipothi.com/chanakya-niti/

https://chanakyanipothi.com/anlon-healthcare-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/vikran-engineering-ipo-date-review-price-allotment-details/

https://chanakyanipothi.com/sme-ipo-watch/current-infraprojects-ipo-gmp-live-updates-and-

https://chanakyanipothi.com/sme-ipo-watch/nis-management-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/globtier-infotech-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/classic-electrodes-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/anondita-medicare-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/abril-paper-tech-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/snehaa-organics-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/sugs-lloyd-ltd-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/sattva-engineering-ipo-date-review-price-allotment-

https://chanakyanipothi.com/sme-ipo-watch/oval-projects-ipo-date-review-price-allotment-details/

https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/

https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/ https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/

https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/ https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/

https://chanakyanipothi.com/whatsapp-group/

Brookfield Reit seals India's record office real estate deal for Rs.13,125 cr

Brookfield India Real Estate Trust (Reit) has signed binding agreements to acquire Ecoworld, a Grade-A office campus spanning 7.7 million square feet (msf) in Bengaluru, for Rs.13,125 crore.

This is India's biggest office transaction, on a 100 per cent acquisition basis, said Nishant Kabra, head, capital markets -North & West India, JLL. Other big deals include the DLF promoters' 40 per cent stake sale in DLF Cyber City Developers (DCCDL) to GIC and buyback of shares by DCCDL for Rs.11,900 crore in 2017 and Blackstone's Rs.7,467 crore investment in Prestige Group's commercial assets in 2021.

"This transaction underscores the growing maturity of India's Reit ecosystem. Reits are actively deploying capital and competing strongly for asset acquisitions, a sign of deepening institutional participation in commercial real estate," said Kabra.

Anuj Puri, chairperson, Anarock Group, termed the deal as the biggest Reit acquisition in India so far. It's a major event in the country's commercial real estate market, Puri said.

Ecoworld is built across 48 acres on Bengaluru's Outer Ring Road -- one of India's busiest office micro-markets.

The Board of the Manager for Brookfield India Reit has proposed to fund the acquisition through Rs.3,500 crore of new debt issuance, Rs. 1,000 crore of cash proceeds from a preferential issue in the second quarter of FY26, and a new equity issuance of Rs.2,500

This is a related-party transaction, as the seller, BSREP III New York FDI I (DIFC) Limited, is part of the Brookfield group. According to two independent valuations, the average value of the asset stood at Rs.14,044.1 crore.

"This acquisition will mark our entry into one of India's strongest office markets, expanding the size of our Reit by over 30 per cent and

Lenskart plans to open its

upcoming smart-glasses platform — B by Lenskart — to India's developer community, inviting consumer app companies and independent developers to create localised use cases and experiences, according to people familiar

Lenskart opens smart-glasses

platform to developers in AI

wearables push

The move positions the eyewear retailer to build one of India's first full-stack wearable ecosystems, integrating hardware, artificial intelligence (AI), and software capabilities.

with the matter.

AI and camera tech to be opened for integration

Under the initiative, Lenskart will make its AI and camera technology accessible to popular consumer platforms such as Zomato, Swiggy, and BookMyShow, as well as to

indie developers.

"This would enable new integrations across food delivery, entertainment, fitness, and navigation," said a person familiar with the matter.

Leveraging its omnichannel retail network, large consumer base, and control over manufacturing and supply chain, Lenskart aims to play a leading role in shaping India's emerging AI-powered wearables market, the sources

Recently, the company showcased a new feature for its B Camera Smartglasses—direct UPI payments.

Users can complete transactions instantly by scanning a QR code with their smart glasses, requiring neither a phone nor a PIN.

Top four life insurance companies covered 14 mn fewer lives in FY25

Bengaluru-based Britannia Industries reported consolidated net profit growth of 23.1 per cent in the July-September quarter compared to the same period last year on the back of relatively stable commodity prices and sustained efforts to optimise costs across the value chain.

The company's revenue grew 3.7 per cent to Rs.4,841 crore in O2FY26 compared to the same period last year. The biscuit major's profit before interest, tax and depreciation was up 21.5 per cent at Rs.1,003 crore. Its net profit came in at Rs.654 crore in Q2FY26.

"The recent GST (Goods and Services Tax) rate rationalisation announced by the government is a welcome

step towards stimulating consumer demand and uplifting the overall economic sentiment in the country. However, transitional challenges arising from the GST-related changes in supply chain, trade and channels had a short-term impact on business during the latter part of the quarter, which is expected to get normalised progressively in the coming quarter," said Varun Berry, vice chairman, managing director and chief executive officer, Britannia Industries.

Berry also said, "The adjacent bakery categories of Rusk, Wafers, and Croissants continued to deliver doubledigit growth for consecutive quarters despite transitionary headwinds, driven by strong momentum in the ecommerce channel, also aiding the in-home consumption of our indulgent and impulse product range of Fudge It Cakes, Pure Magic Stars and Tarts, Jim Jam, Little Hearts amongst others."

He further said that in his outlook that looking ahead, the biscuit major aims to drive business through healthy volume-led growth as the company continues to strengthen its presence across different geographies with regional-consumer centric product and distribution strategies, price competitiveness while leveraging its brand strength to sustain market leadership amid proliferation of multiple local players in different states and

Paytm founder Sharma bets on AI-led revenue growth, cost-efficiency

After helping rein in costs, AI gives us better efficiencies Paytm's artificial intelligence (AI)-led product focus is expected to further drive revenue growth, founder and chief executive officer (CEO) Vijay Shekhar Sharma said on Wednesday.

The company will target its online and offline merchants, including the small and large ones, for these AI products.

"AI is a revenue line item. It brings newer service, newer business, (and) phenomenally more number of things that we can do... Up till now, we've been putting it into the cost side, efficiency side. While there will be some optimisation (further), but not material enough," he said, in a call with analysts post its earnings.

Paytm has slashed its indirect expenses, which includes employee costs, marketing and cloud costs, by 18 per cent to Rs.1,064 crore in the second quarter of financial year 2026 (O2FY26), as compared to Rs.1,298 crore in O2FY25.

Sequentially, indirect costs were down from Rs.1,079 crore in Q1FY26.

"The starting point is that

and better insights, in addition to new revenue generating products. For example, if we are able to use better insights to reduce the credit costs for our partners, then that translates into higher collection revenue," said the company's president and group chief financial officer (CFO) Madhur Deora.

To start with, Paytm is leveraging AI to enhance its soundbox or AI devices, equipping merchants with AIpowered agents that provide insights, analytics, and voicebased commands.

The company may later earn by charging a subscription for these services.

"The idea is that a small business can have a chief operating officer, chief finance officer, chief marketing officer practically there in the shop in an AI component. We are building these devices, which are specifically made and manufactured by us," Sharma

The company has a base of 47 million registered merchants. The subscription merchants such as those who use its devices stand at 13.7 million as

Paytm is also pursuing international expansion, exploring two distinct models as blueprints for its growth abroad.

First, the company plans to forge tech partnerships with established local players in foreign markets. Second, it plans to enter new markets with lucrative payments margins through its wholly owned or majority controlled entities.

In 2024, Paytm's wholly owned Singapore entity sold its stake in Japanese fintech corporation PayPay for ?2,364 crore. It will eye emerging markets such as Southeast Asia and developed ones too, Sharma added.

One97 Communications (OCL), operator of Paytm brand, reported a net profit of ?21 crore for the second quarter of financial year 2026 (Q2FY26).

This was in contrast to the Rs.928 crore profit the company reported in the same quarter of the last year, which was boosted by an exceptional gain from the sale of its movie ticketing and events business to Zomato.

PRATIKSHA CHEMICALS LIMITED REGD. OFFICE: 3RD FLOOR, HK COMPLEX, OPP.

DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007 CIN: L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in PH: 079-26632390 E-MAIL: exports@dharapratiksha.com

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE (Rs. in lakhs) QUARTER ENDED ON 30.09.2025

	(No. III laki									
CD	PARTICULARS	Quarter ended			Half	Half Year				
SR No.		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	30.09.2024	Ended 31.03.2025			
1 2	Total income from operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	217.75	116.86	165.53	334.66	391.36	610.82			
3	Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or	(77.06)	(218.66)	(11.93)	(295.72)	(7.87)	(531.73)			
4	Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or	652.01	(211.16)	(11.93)	440.85	(7.87)	(771.11)			
5	Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income	659.73	(211.16)	(13.00)	448.57	(17.83)	(766.47)			
6 7	(after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous	659.73 557.03	(211.16) 557.03	(13.00) 557.03	448.57 557.03	(17.83) 557.03	(766.47) 557.03			
8	Year Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	(511.88)		(193.99)	(511.88)	(193.98)	(960.46)			
	Basic : Diluted :	11.84 11.84	(/	(0.23) (0.23)	8.05 8.05	(0.32) (0.32)	(13.76) (13.76)			

1.The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Compan website (www.pratikshachemicals.in)

2. The result of the Quarter ended on 30th September, 2025 were reviewed by the Audit Committee an approved by the Board of Director at its meeting held on 5th November,2025.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED MR. JAYESH KANTILAL PATEL DIRECTOR (DIN: 000401109)

Place: Ahmedabad Date: 5th November, 2025

બેંકોના પરિણામો વધારે પ્રોત્સાહક આવશે તે સંભાવના

કેનેરા બેંકમાં પણ તેજીની શરૂઆત થઈ ગઈ

અંક : પદ તા.૬-૧૧-૨૦૨૫



દિવાળી પછી અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં જે ઘટાડો કરવામાં આવ્યો તેની ખૂબ જ પોઝિટિવ અસર ગુરુવારના બજાર ઉપર જોવાઈ છે અને સેન્સેક્ષ-નિફ્ટીમાં તોતિંગ ઉછાળો જોવાયો. આગલા દિવસે બુધવારે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં જે ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો તેને કારણે સેન્ટીમેન્ટ બુલીશ થઈ ગયું છે.

પોતાના વ્યાજદરના ઘટાડા અંગેના પ્રવચનમાં ફેડરલ રિઝર્વ હજી પણ નાણાકીય પોઝિશન થોડીક મુશ્કેલ હોવાનો દાવો કર્યો છે અને તેને કારણે હવે ડિસેમ્બરની મિટિંગમાં વ્યાદરમાં ઘટાડો જોવાશે તેવી આશા નહિ રાખવાનું પણ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યું છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ૩.૭૫થી ૪ ટકા સુધી લઈ જવામાં આવ્યો અને સતત બીજા વખતે વ્યાજદરમાં ઘટાડો કરાયો હોવાને કારણે સેન્ટીમેન્ટ ખૂબ જ બુલીશ થઈ ગયું છે. અગાઉ સપ્ટેમ્બર, ૨૦૨૫માં વ્યાદજરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરાયો હતો અને હવે ઓક્ટોબરની મિટિંગમાં વ્યાજદર ઘટાડવામાં આવ્યો છે અને આગામી સમયગાળામાં આર્થિક

આંકડાઓને ધ્યાનમાં રાકીને ભવિષ્યમાં

ગામની ગપસપ

- **ઇન્ડેસ**, સેન્સેક્ષ અને નિફ્ટીમાં હજી તીવ્ર વધઘટનો તબક્કો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાયા પછી ભારતીય રિઝર્વ બેંક પણ તે ટ્રેન્ડને અનુસરે તે સંભાવના મજબૂત અને તેમ છતાં પણ બજારમાં અત્યારે ઉત્સાહનો અભાવ.
- શ્રીરામ ફિનાન્સ, દિવાળી અગાઉ લગભગ ચાર અઠવાડિયાથી આ શેર લેવડાવતા હતા. અત્યારે વધીને રૂા. ૭૩૮ ઉપર આવી ગયો છે અને હવે આ શેરમાં રૂા. ૭૫૦થી રૂા. ૭૫૪ આસપાસ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેજો, લાંબું ખેંચવામાં મજા નથી.
- **ાઇટન**, તાતા ગ્રૂપની આ કંપની દાગીનાના ઓર્ગેનાઈઝ વેપારમાં પ્રથમ સ્થાન ધરાવે છે. મોંઘા ભાવે લેન્સકાર્ટના શેરમાં અરજી કરવી તેને બદલે ટાઈટનના શેરમાં તમે આઈવેરનો જંગી બિઝનેસ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત સાડીના અતિશય વિશાળ બિઝનેસમાં પણ આ કંપનીનું મોટું કામકાજ, અત્યારના રૂા. ૩૭૫૦ના ભાવે થોડા થોડા કરીને શેરો ભેગા કરતા રહેજો, મજબૂત તેજીના તબક્કામાં આગળ વધ્યો છે અને આવતા થોડા દિવસોમાં રૂા. ૩૮૦૦ અને તે પછી રૂા. ૩૮૫૫નો ભાવ જોવા મળવાની ગણતરી.
- **તાતા સ્ટીલ**, ડિવિડન્ડની દેષ્ટિએ સુંદર રિટર્ન આપી રહેલા આ શેરમાં છેક રૂા. ૧૩૨ના ભાવથી રોકાણ કરવાનું દર્શાવીએ છીએ અને લાંબાગાળે રૂા. ૪૦૦ના ભાવનું લક્ષ્યાંક પણ અનેક વખત આપ્યું છે. અત્યારે વધીને રૂા. ૧૮૪-૧૮૫ ઉપર, થોડાક શેરો શોર્ટટર્મ માટે અને થોડાક શેરો લોંગટર્મ માટે લઈને મૂકી શકાય. શોર્ટટર્મમાં રૂા. ૧૯૦થી રૂા. ૧૯૪નો ભાવ જોવા મળે, જ્યારે ત્રણેક વર્ષના રોકાણમાં લગભગ રૂા. ૪૦૦ના ભાવની ટોચના ફંડ મેનેજરની ગણતરી.
- **રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ**, નબળાઈનો તબક્કો છોડીને હવે આ શેર તેજીના તબક્કામાં દાખલ, રૂા. ૧૩૭૦ આસપાસ બોટમ બતાવ્યું અને અત્યારે રૂા. ૧૪૮૮ ઉપર આવ્યો છે, જીઓના આઈપીઓની તૈયારી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે અને મર્ચન્ટ બેંકરો પસંદ કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તે પહેલા આ શેરમાં રૂા. ૧૫૦૦ અને તે પછી રૂા. ૧૫૧૨ અને તે પછી રૂા.૧૫૩૦નો શોર્ટટર્મમાં જ ભાવ જોવા મળવાની ગણતરી. શોર્ટટર્મ માટે થોડાક શેરો લઈને મૂકી દેજો.
- **ા લાર્સન એન્ડ ટૂબો**, મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધનો કપરો સમય ચાલી રહ્યો હોવા છતાં કંપનીની કામગીરીમાં ખૂબ જ સુંદર સુધારો, અને ઓર્ડરોમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. શેર અત્યારે રૂા. ૩૯૮૭ ઉપર, લીધા ન હોય તો થોડાક શેરો બે મહિના માટે લઈને મૂકી દેજો અને આવતા બે મહિના દરમ્યાન ઉપરમાં રૂા. ૪૧૮૧ અને તે પછી ધીરે ધીરે રૂા. ૪૨૮૨નો ભાવ જોવા મળવાની આરએસની વાત.
- **એસબીઆઇ લાઇફ ઇન્સ્થોરન્સ**, એમ તો ખાનગી વીમા કંપનીઓના શેરમાં લાંબો કસ નથી, પરંતુ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ રૂા. ૧૯૬૮ ઉપર આકર્ષક, રૂા. ૧૭૫૫થી આ શેરમાં તેજી શરૂ થઈ છે. પ્રાઈવેટ વીમા કંપનીઓમાં સૌથી વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો જોરદાર સપોર્ટ પણ મળે છે. શોર્ટટર્મમાં જ રૂા. ૧૯૮૨ અને તે પછી રૂા. ૨૦૦૦ અને તે પછી રૂા. ૨૦૨૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત.
- જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલની પાછળ પાછળ આ શેર પણ તેજીતરફ દોડી રહ્યો છે. અત્યારે રૂા. ૧૨૧૦નો ભાવ, દસેક શેર લઈને મૂકી દેજો અને થોડા દિવસોમાં જ રૂા. ૧૨૩૨ અને તે પછી રૂા. ૧૨૪૩નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત.
- **હિન્ડાલ્કો**, આ શેર ભેગા કરવાનું પણ દિવાળી અગાઉ સતત દર્શાવેલું, વધીને રૂા. ૮૬૧ ઉપર આવ્યો છે અને હવે રૂા. ૮૭૦થી રૂા. ૮૭૩ વચ્ચે થોડુંક પ્રોફિટ બુકિંગ કરીને હળવા થવું, નફો કાગળ ઉપર રહી જાય તે ખોટું, હિન્ડાલ્કોમાં મળેલા પૈસા તાતા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલમાં શિફ્ટ કરી શકાય.
- **નેસ્લે ઇન્ડિયા**, બીજા ક્વાર્ટરના પ્રોત્સાહક પરિણામો પછી આ શેરમાં આકર્ષણ વધ્યું, સારા ચોમાસાને કારણે પણ નેસ્લે ઇન્ડિયાના વેચાણોમાં સુધારાની ગણતરી, રૂા. ૧૨૮૦ના ભાવે ખોટો નથી અને શોર્ટટર્મમાં સુંદર વૃદ્ધિ સાથે રૂા.૧૨૯૦ અને તે પછી રૂા.૧૩૦૩નો ભાવ જોવા મળવાની સંભાવના

આંકડા ખૂબ જ પ્રોત્સાહક આવવાને કારણે આ સેક્ટર અંગેનો આશાવાદ વધ્યો છે.

દિવાળી પછી આઈપીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગયા છે અને તેમાં પણ જે પ્રકારનો પ્રતિભાવ છે તેને કારણે હજી પણ આઈપીનો પ્રવાહ વધારે વધે તે સંભાવના દેખાય છે. અને એકંદરે બજારનો મૂડ પોઝિટિવ રહેવાની સંભાવના મજબૂત છે.

ટોચના એનાલિસ્ટો દ્વારા વિવિધ બેંકિંગ કંપનીઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવામાં આવ્યો છે અને તેમના મંતવ્ય મુજબ બેંકો દ્વારા ધિરાણ વૃદ્ધિ હાંસલ કરવાને બદલે અત્યારના તબક્કે એસેટ ક્વોલિટી ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. રિટેઈલ ધિરાણ તો એકદમ સિલેક્ટિવ થઈ ગયું છે અને બેંકોએ ઊંચો સિબિલ દર હોય અને વ્યવસ્થિત ડોક્યુમેન્ટ મળી શકે તેવી પાર્ટીઓને જ ધિરાણ આપવાનું પસંદ કર્યું છે. હાઉસીંગ લોન, પ્રોપર્ટી સામેના ધિરાણો અને બિઝનેસ લોનમાં એક્સપોઝર ખૂબ જ ચકાસણી પછી લેવામાં આવે છે. અને અત્યારના તબક્કે ઓછો સિબિલ સ્કોર હોય તે પ્રકારના લેણદારોને પડતા મૂકવાનું મોટા ભાગની બેંકો કરી રહી છે.

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હાઈસ્કોર ધરાવનાર પગાર વ્યક્તિઓને ધિરાણ આપવાનું પસંદ કરાય છે.

કોર્પોરેટ સેગ્મેન્ટમાં વિવિધ બેંકોમાંથી અત્યારે એક્સિસ બેંક વધારે એગ્રેસીવ છે.

આ તમામ પાસાઓને કારણે આગામી સમયગાળામાં બેંકોના પરિશામો વધારે પ્રોત્સાહક આવશે તે સંભાવના ખુબ જ મજબૂત છે.

સ્ટેટ બેંક સરકાર હસ્તકની આ બેંક દ્વારા હજી તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિશામો જાહેર નથી થયા, પરંતુ પરિશામો એકંદરે પ્રોત્સાહક આવશે તે સંભાવના અતિશય મજબૂત છે. સ્ટેટ બેંકનો શેર છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ૩ ટકા વધ્યો છે અને અત્યારે૧૦.૯૩ના પીઈરેશિયો ઉપર મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેની આવકોમાં ૧૨.૭૧ ટકાનો વૃદ્ધિદર જોવાયો, જયારે તેનો નફો છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૩૬ ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે. અને આ પાસું ધ્યાનમાં રાખીએ તો આગામી દિવસોમાં

https://chanakyanipothi.com/

https://sahifund.com/ https://sahifund.com/sip/

5) Sahifund bottom

https://chanakyanipothi.com/ipo-gmp/

https://chanakyanipothi.com/intraday-trading/

https://chanakyanipothi.com/grey-market-premium/

https://chanakyanipothi.com/ipo-subscription-status/

https://chanakyanipothi.com/upcoming-ipos-2025/

2) https://sahifund.com/latest-new-fund-offers/

https://chanakyanipothi.com/news-crux/

https://chanakyanipothi.com/fii-data-today/

https://sahifund.com/fii-dii-buy-sell-activity/

https://chanakyanipothi.com/chanakya-niti/

https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/

https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/

1) https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/

3) https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/

4) https://sahifund.com/icici-prudential-flexicap-fund/

https://chanakyanipothi.com/best-stock-to-buy-today/

રૂા. ૯૪૧ વાળા આ શેરમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૯૫૦ અને તે પછી રૂા. ૯૬૧નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. શોર્ટટર્મ માટે પણ આ શેર ઉપર ફ્રોક્સ વધારી શકાય. આ જ પ્રકારે **પંજાબ નેશનલ બેંક**માં પણ સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા

ખૂબ જ પ્રોત્સાહક આવ્યા છે. આગલા વર્ષના રૂા. ૨૦૬૫ કરોડની સરખામણીમાં પંજાબ નેશનલ બેંકે રૂા. ૨૩૫૬ કરોડનો ફિનાન્સિંગ નફો હાંસલ કર્યો છે. જ્યારે કરવેરાની જોગવાઈ પછીનો નકો રૂા. ૪૭૩૯ કરોડથી વધીને સપ્ટેમ્બર, ૨૦૨૫માં રૂા. ૫૧૨૫ કરોડ થયો અને બેંક દ્વારા રૂા. ૪.૪૬ની શેરદીઠ કમાણી હાંસલ થઈ છે. પંજાબ નેશનલ બેંકનો શેર અત્યારે છેલ્લા એક અઠવાડિયા દરમ્યન ૨.૪૪ ટકા વધીને રૂા. ૧૨૨ ઉપર આવ્યો છે અને આ શેરમાં હવે લાંબી તેજીની જગ્યા છે અને તેથી લગભગ ત્રણ મહિનાના એન્ગલથી આ શેર લઈને મૂકી દેવાય. સપ્ટેમ્બર, ૨૦૨૫માં રૂા. ૧૦૨ ઉપર મળી રહ્યો હતો અને એક જ મહિનામાં આ શેર લગભગ ૨૦ ટકા વધીને રૂા. ૧૨૧ ઉપર આવ્યો છે અને આગામી દિવસોમાં આ શેરમાં રૂા. ૧૩૦ ખૂબ જ ઝડપથી જોવા મળે તેવી સંભાવના છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

શોર્ટટર્મ એન્ગલથી ચુનિચન **બેંક**ના શેરમાં પણ આકર્ષણ વધી રહ્યું છે. યુનિયન બેંકમાં પણ હજી સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા અંગે આતુરતાપૂર્વક રાહ જોવાય છે. અત્યારે આ શેર ફક્ત ૫.૯૪ના પીઈરેશિયો ઉપર મળે છે અને તેમાં અત્યારના ભાવે ૩.૨૫ ટકાનું યીલ્ડ છૂટે છે. યુનિયન બેંકની એક ખાસ બાબત એ છે કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેણે નફામાં ૫૦.૭૦ ટકાનો તોતિંગ વૃદ્ધિર હાંસલ કર્યો છે અને તેથી લગભગ ૨થી ૩ મહિનાના એન્ગલથી આ શેરમાં પણ ફોકસ વધારી દેવાય. યુનિયન બેંક સપ્ટેમ્બર મહાિનની શરૂઆતમાં રૂા.૧ ૨૫ ઉપર મળતો હતો અને ત્યારે ભારપૂર્વક



રિઝર્વ દ્વારા સ્પષ્ટ કરાયું છે. ૧૨

સભ્યોમાંથી ૧૦ સભ્યો દ્વારા વ્યાજદરમાં

ઘટાડો કરાયો છે. જયારે એક સભ્ય દ્વારા

૫૦ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં

આવે તેવી માંગણી કરાઈ છે. તેમ છતાં

ભવિષ્યમાં વ્યાજદર ઘટાડાશે કે કેમ તે

પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

અંગે તેમણે કોઈ જ સ્પષ્ટતા કરવાની ના પાડી. અમેરિકામાં હજી ફુગાવો એપેક્ષા કરતા થોડોક વધારે છે. ઓક્ટોબર મહિનામાં જે કન્ઝ્યુમર ફુગાવાના આંકડા જાહેર થયા તેમાં ત્રણ ટકાનો દર જોવાયો છે. જ્યારે ઓગસ્ટ મહિના દરમ્યાન ૨.૯ ટકાનો ફુગાવાનો દર હતો અને તે માટે ફેડરલ રિઝર્વે ટેરિફનું કારણ આપ્યું છે. અમેરિકન પ્રમુખ દ્વારા જે ટેરિફ લગાડવામાં આવી તેને કારણે ચીજવસ્તુઓની કિંમતો વધી અને તેથી ફુગાવો વધ્યો હોવાનં દર્શાવીને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરાયો છે સામે પક્ષે લેબર માર્કેટમાં પણ થોડીક સ્લોડાઉનની અસર છે. અને આર્થિક પરિસ્થિતિ થોડીક અનિશ્ચિત હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે. ફેડરલ રિઝર્વના આ પગલા

પછી હવેની મિટિંગમાં રિઝર્વ બેંક દ્વારા પણ વ્યાજદરમાં નાનો ઘટાડો કરાશે તે આશાવાદ વધ્યો છે અને તેની પણ ગુરુવારના બજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી હતી.

એકંદરે કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિશામો પ્રોત્સાહક આવ્યા છે અને તેમાં પણ બેંકિંગ કંપનીઓના

Important Weblinks for Today

ડ્રાઈવર ?

ડ્રાઈવર, રસોયા, staffavailable.com नोક्२ शोधवा हवे ખૂબ જ સરળ staffavailable.com ના એકદમ અલગ

પ્રકારના અને દેશમાં એકમાત્ર આવી સવલત ઓફ્ટ કરતાં પ્લેટફોર્મ ઉપ૨ તમારી જરૂરિયાત મૂકી દો

तह्न हो

https://staffavailable.com/

https://chanakyanipothi.com/vikran-engineering-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/current-infraprojects-ipo-gmp-live-updates-and-review/ https://chanakyanipothi.com/sme-ipo-watch/nis-management-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/globtier-infotech-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/classic-electrodes-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/anondita-medicare-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/abril-paper-tech-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/snehaa-organics-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/sugs-lloyd-ltd-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/sattva-engineering-ipo-date-review-price-allotment-details/ https://chanakyanipothi.com/sme-ipo-watch/oval-projects-ipo-date-review-price-allotment-details/

https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/ https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/ https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/ https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/ https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/

https://chanakyanipothi.com/anlon-healthcare-ipo-date-review-price-allotment-details/

https://chanakyanipothi.com/whatsapp-group/

લેવાનું કહ્યું હતું. જાન્યુઆરીમાં રૂા. ૧૦૦ ઉપર હતો અને જાન્યુઆરીના લેવલથી જોઈએ તો અત્યાર સુધીમાં આ શેરે ૪૫ ટકાનું સુંદર રિટર્ન આપ્યુ છે અને હજી તો આ શેરમાં મજબૂત તેજીની શરૂઆત થઈ છે. આવતા થોડા દિવસોમાં રૂા. ૧૫૨ અને તે પછી રૂા.

બેંકના શેરે છેલ્લા થોડા દિવસોમાં સુંદર રિટર્ન આપી દીધું. ઇન્ડિયન બેંક માર્ચ મહિનામાં રૂા. ૫૦૦ ઉપર મળી રહ્યો હતો અને અત્યારે રૂા. ૮૫૪ ઉપર છે. ચાણક્યના ભૂતકાળના અંકો ચેક કરશો તો ઇન્ડિયન બેંક પણ ભારપૂર્વક લેવાની વાત કરેલી છે. લગભગ સાત મહિના દરમ્યાન જે રીતે આ શેરે ૬૦ ટકાનું રિટર્ન આપ્યું છે તે પછી હવે તેમાં રૂા. ૮૭૧ આસપાસ તેજી થોડીક થાક ખાય તે સંભાવના મજબૂત છે. પરંતુ તે લેવલ ઉપરપણ આ શેર ફક્ત ૯.૭૪ના પીઈરેશિયો ઉપર હશે. અને તે રીતે જુઓ તો આ શેરમાં રૂા. ૮૭૧ આસપાસ તેજી થોડીક થાક ખાયા પછી નવી તોફાની તેજી શરૂ થનવાની ગણતરી છે અને તેથી લોંગટર્મ માટે પણ આ શેર જાળવી રખાય.

૧૬૦નો ભાવ જોવા મળવાની ગણતરી

કેનેરા બેંકમાં પણ તેજીની શરૂઆત થઈ ગઈ છે. કેનેરા બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમ્યાન સામાન્ય પરિણામો દર્શાવ્યા છે. ધિરાણમાંથી નફામાં ખાસ કોઈ ઉછાળો નથી પરંતુ કરવેરાની જોગવાઈ પછીનો નફો રૂા. ૨૨૭૭ કરોડથી વધીને રૂા. ૩૧૦૯ કરોડ થયો છે. અને આ પાસું ધ્યાનમાં રાખીએ તો આ શેરમાં અત્યારે લગભગ ૩૦થી ૩૫ ટકાનો સુંદર વૃદ્ધિદર જોવાયો છે. રૂા. ૧૨૮વાળા આ શેરમાં હજી તેજી એકદમ ધીરે ધીરે સુધરવાની જગ્યા છે, પરંતુ રોકાણ જાળવી શકાય.

રૂા. ૪૦વાળા **ઇન્ડિયન** ઓવરસીઝ બેંકમાં પણ લાંબી તેજીની જગ્યા છે. અત્યારે એકદમ ઝડપી ઉછાળો નથી દેખાતો, પરંતુ શેર લઈને તેમાં પણ લગભગ ચારેક અઠવાડિયાના મકી દેવાય.

રૂા. ૨૭૩વાળા **બેંક ઓફ** બરોડાના શેરમાં પણ આકર્ષણ વધતું જાય છે. છેલ્લા ક્વાર્ટર દરમ્યાન ભલે તેનો નફો ૨૬ ટકા ઘટ્યો હોય, પરંતુ વેલ્યૂએશન અત્યારે ખૂબ જ આકર્ષક છે અને તેથી આ શેરમાં આવતા ત્રણ મહિના દરમ્યાન સુંદર રિટર્નની જગ્યા છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ખૂબ નથી. જ પ્રોત્સાહક પરિણામો હાંસલ થયા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધિરાણમાંથી મળતો નફો જૂન ક્વાર્ટરના રૂા. ૮૭૮ કરોડથી વધીને રૂા. ૯૭૩ કરોડ થયો છે અને ગયા વર્ષના જૂનના રૂા. ૫૮૮ કરોડની સરખામણીમાં જોઈએ તો નફામાં ૬૫

આઇડીબીઆઇ બેંકના શેર રૂા. ૧૦૧ ઉપર છે. અને આ શેરમાં પણ આગામી દિવસોમાં ધીમા સુધારાની જગ્યા છે. શોર્ટટર્મમાં જ શેર રા. ૧૦૧થી ઊંચકાઈને રૂા. ૧૧૦ આસપાસ આવી જવાની સંભાવના.

આરબીએલ બેંકનો શેર રા. ૩૨૪ ઉપર મળી રહ્યો છે અને આ શેરે શોર્ટટર્મ એન્ગલથી ઈન્ડિયન પણ માર્ચ મહિનાના રૂા.૧ ૫૦ના લેવલથી લગભગ ૧૦૦ ટકાનું રિટર્ન આપી દીધું છે. એક તબક્કે એચડીએફસી બેંકને આરબીએલ બેંક હસ્તગત કરવામાં રસ હતો તેમ અગાઉના એનાલિસીસમાં અનેક વખત દર્શાવ્યું છે અને દરેક વખતે આ શેર લેવાનું કહ્યુ ંહગતું, માર્ચ મહિનાના લેવલથી ભલે ૧૦૦ ટકાનો ઉછાળો જોવાયો હોય પરંતુ હજી પણ આગામી દિવસોમાં રૂા. ૩૫૩થી રૂા. ૩૭૦ વચ્ચે જવાની જગ્યા છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

જમ્મુ-કાશ્મીર બેંક અત્યારે રૂા. ૧૦૭ ઉપર છે અને તેમાં ધીમો સુધારો આગળ વધે તેવી ગણતરી છે. એકદમ મોટો ઉછાળો જોવા મળે તેવી કોઈ આશા નથી.

સરકારી બેંકોમાં **બેંક ઓફ** ઇન્ડિયા એ પણ ખૂબ જ સુંદર પરિણામો દર્શાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નેટનફો ૩૮ ટકાના દરે વધ્યો છે. અને આગામી દિવસોમાં આ શેરમાં તોતિંગ ઉછાળા સાથે રૂા. ૧૫૦નો ભાવ આવી જવાની જગ્યા છે અને તેથી લગભગ ચારેક અઠવાડિયાના એન્ગલથી થોડાક બેંક ઓફ ઇન્ડિયાના શેર લઈને મકી શકાય.

પ્રાઈવેટ સેક્ટર બેંકોમાં **એચડીએફ્સી બેંક**માં ધીમો સુધારો આગળ વધતો જાય છે. આ બેંકે પણ છેલ્લ ાપાંચ વર્ષ દરમયા નફામા ૨૧ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. અત્યારના રૂા. ૧૦૦૪ વાળા આ શેરમાં પણ ધીમો અપટ્રેન્ડ જોવા મળવાની જગ્યા છે અને એન્ગલથી સુંદર રિટર્ન સાથે રૂા. ૧૦૬૦નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તેથી નાનું રોકાશ કરી શકાય.

આઈસીઆઈસીઆઈ બેંક રૂા. ૧૩૬૬ ઉપર છે અને તેમાં શોર્ટટર્મમાં કોઈ કસ નથી દેખાતો. વેલ્યૂએશન થોડુંઘણું આકર્ષક કહી શકાય પરંતુ નજીકના થોડા અઠવાડિયામાં આ શેરમાં એકદમ મોટી વૃદ્ધિ આવી જવાની જગ્યા દેવાય.

એક્સિસ બેંક અત્યારે રૂા. ૧૨૪૨ ઉપર છે અને આગામી દિવસોમાં સુંદર વૃદ્ધઇની જગ્યા છે. પ્રાઈવેટ સેક્ટરની આ બેંકનું સૌથી મોટું આકર્ષણ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેના નફામાં ૭૨ ટકાનો સુંદર વૃદ્ધિદર. અને ટકાનો તોતિંગ ઉછાળો થયો છે. બેંક દ્વારા તેની વર્કિંગ કેપિટલની કરવેરાની જોગવાઈ પછી પણ બેંકે રૂા. જરૂરિયાત પણ ૧૪૦ દિવસથી ઘટાડીને ૨.૧૭ની શેરદીઠ કમાણી મેળવી છે. ૭૧ દિવસ કરી નાખી છે. અને આ અત્યારે આ શેર ૭.૫૦ના પીઈરેશિયો પાસાને ધ્યાનમાં રાખીએ તો રૂા. **લાઇફ**ના શેરમાં પણ આકર્ષણ નહિવત ઉપર મળી રહ્યો છે અને તેમાં પણ ૧૨૪૨ વાળા આશેરમાં લગભગ છે અને નાની રેન્જમાં જ ભાવ અથડાઈ જાળવવાની તૈયારી સાથે થોડુંક રોકાણ પ૦થી ૬૦ ટકા રિટર્ન આવતા થોડા જાય તેવી ગણતરી છે.

મહિનામાં છૂટી જવાની જગ્યા છે અને તેથી ચાણક્યના ચોઈસવાળા બેંકિંગ શેરમાં એક્સિસ બેંકને ભારપૂર્વક દર્શાવીએ છીએ.

કોટક બેંકમાં વેલ્યૂેશન થોડુંક મોંઘુ કહી શકાય. અત્યારના રૂા ૨૧૪૧ વાળા આ શેરમાં મોટો ઉછાળો નથી દેખાતો.

આઇડીએફ્સી ફર્સ્ટ બેંકનો રૂા. ૭૯વાળો શેર સુંદર રિટર્ન આપી જવાની જગ્યા છે. છેલ્લા ક્વાર્ટરમાં નફો ૬૪ ટકા વધ્યો હતો. અત્યારના ભાવથી આ શેરમાં થોડા દિવસોમાં જ રૂા. ૮૪-૮૮નો ભાવ આવવાની સંભાવના છે અને તેથી નાનં રોકાણ કરી

રૂા. ૨૨.૪૭ ઉપરના ચસ **બેંક**ના શેરે ભલે છેલ્લા બે વર્ષ દરમ્યાન ખાસ રિટર્ન નથી આપ્યું. બે વર્ષ અગાઉ જયારે ટેકઓવરના સમાચારો ચાલુ થયા ત્યારે આ શેર રૂ. ૨૦ આસપાસ હતો અને તેની ઉપર સામાન્ય બેંક વ્યાજ પણ અત્યાર સુધી છૂટ્યું નથી. તેમ છતાં રૂા. ૨૨.૪૭વાળા આ શેરને ધિરજપૂર્વક જાળવી રાખવો ફાયદાકારક છે. જાપાનની બેંક પોતાનું હોલ્ડિંગ ૨૫ ટકા સુધી સિમિત રાખશે તેવા સમાચાર પછી આ શેરમાં તેજીને બ્રેક લાગી ગઈ છે.

ભારતમાં પ્રાઈવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓનું ભાવિ અતિશય મજબૂત હોવા છતાં ઇન્સ્યોરન્સ શેરોમાં હજી તદ્દન સામાન્ય રિટર્ન છેલ્લા ત્રણ વર્ષમાં છૂડ્યું છે. એચડીએફસી લાઈફ **ઇન્સ્ચોરન્સ** અત્યારે રૂા. ૭૪૯ ઉપર છે અને આ શેરમાં હજી થોડોક સમય નાની વધઘટમાં ભાવ અથડાય જાય તે સંભાવના મજબૂત છે. શેર અત્યારે ૮૫ના પીઈરેશિયો ઉપર ચાલે છે અને નફામાં પણ ખાસ કોઈ મોટો ઉછાળો નથી. છેલ્લા પાંચ વર્ષમાં માંડ પ ટકાનો વૃદ્ધિદર આ કંપનીએ દર્શાવ્યો છે.

સરખામણીમાં એસબીઆઈ લાઈફ ઈન્સ્થોરન્સ વધારે રિટર્ન આપી શકશે તેમ દર્શાવેલું. છેલ્લા એક અઠવાડિયામાં આ શેરે ૬.૪૦ ટકાનું રિટર્ન આપ્યુ છે પરંતુ તેમાં પણ નફામાં માંડ ૧૧.૨૮ ટકાની વૃદ્ધિ છેલ્લા પાંચ વર્ષમાં જોવાઈ છે. અત્યારના રૂા. ૧૯૫૯ના લેવલથી આ શેરમાં શોર્ટટર્મમાં રૂા. ૨૦૮૨નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તે લેવલ આસપાસ પ્રોફિટ બુકિંગ શરૂ કરી

એલઆઈસી ઓફ ઇન્ડિયા અત્યારે રૂા. ૯૦૮ ઉપર છે અને આ શેરમાં પણ નાની રેન્જમાં જ ભાવ અથડાયા કરે તે સંભાવના મજબૂત છે. તાજેતરમાં અદાણી ગ્રુપને મોટું ધિરાણ આપ્યાના સમાચાર પછી આ શેર તરફની ફેન્સી ડાઉન થઈ છે. અને તેથી અત્યારના ભાવથી આ શેરમાં નવા રોકાણની સલાહ નથી.

આઈસીઆઈસીઆઈ

PRATIKSHA CHEMICALS LIMITED REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP.

DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007

CIN: L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in PH: 079-26632390 E-MAIL: exports@dharapratiksha.com EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE

QUARTER ENDED ON 30.09.2025 (Rs. in lal										
	PARTICULARS	Quarter ended			Half Year		Year			
SR No.		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	30.09.2024	Ended 31.03.2025			
1 2	Total income from operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	217.75	116.86	165.53	334.66	391.36	610.82			
3	Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or	(77.06)	(218.66)	(11.93)	(295.72)	(7.87)	(531.73)			
4	Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or	652.01	(211.16)	(11.93)	440.85	(7.87)	(771.11)			
5	Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income	659.73	(211.16)	(13.00)	448.57	(17.83)	(766.47)			
5	(after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous	659.73 557.03	(211.16) 557.03	(13.00) 557.03	448.57 557.03	(17.83) 557.03	(766.47) 557.03			
8	Year Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	(511.88)		(193.99)	(511.88)	(193.98)	(960.46)			
	Basic : Diluted :	11.84 11.84	(3.79) (3.79)	(0.23) (0.23)	8.05 8.05	(0.32) (0.32)	(13.76) (13.76)			

Notes:

Place: Ahmedabad

Date: 5th November, 2025

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Compan website (www.pratikshachemicals.in)

2. The result of the Quarter ended on 30th September, 2025 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 5th November,2025.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED MR. JAYESH KANTILAL PATEL **DIRECTOR**

(DIN: 000401109)